

બાર કોડ



IDBI BANK

બાર કોડ

ભાગ 1નું એસબીએ

નિવાસી નાગરિકો/એકલ માલિકીની કંપની માટે અકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ

કૃપા કરી ફોર્મ સ્પષ્ટ અક્ષરોમાં અને કાળી શાહીમાં જ ભરો.

વેલકમ કિટ અકાઉન્ટ

સેવિંગ્સ અકાઉન્ટ/કરન્ટ અકાઉન્ટ/સુવિધા ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી)

તારીખ:

શાખા વ્યવસ્થાપ, આઈડીબીઆઈ બેન્ક લિમિટેડ

સંકેવાચસીઆર આઈડી

ભાગ I

કૃપા કરી તમારી શાખા, એસઓએલ ખાતે મારું એકલ/અમારું સંયુક્ત /એકલ માલિકીનું અકાઉન્ટ ખોલો.

અકાઉન્ટના વિકલ્પો

☐ રોયલ પ્લસ ☐ રોયલ ☐ પ્રીફર્ડ ☐ સુપર સેવિંગ્સ ☐ સુપર શક્તિ ☐ જ્યુનિલી પ્લસ ☐ પાવર ફિક્સ ☐ સુવિધા એફડી ☐ પાવર પ્લસ ☐ સેલરી ☐ ફ્લેક્સી કરન્ટ
☐ ફેમિલી અકાઉન્ટ-લિંક્ડ સેલરી અકાઉન્ટ ☐ પેશન અકાઉન્ટ (કેન્દ્ર સરકારી કર્મચારી) ☐ અન્ય (કૃપા કરી ચોખવટ કરો)

અરજદારની વિગતો

શીર્ષક	મૂળ નામ	પરચેનું નામ	અટક
1લો અરજદાર:			
2જો અરજદાર:			
3જો અરજદાર:			
4થો અરજદાર:			

મોજૂદ કરન્ટ અરજદાર: 1લો અરજદાર: 2જો અરજદાર: 3જો અરજદાર: 4થો અરજદાર:

કંપનીનું નામ (એકલ માલિકી માટે)

સગીરને નામે અકાઉન્ટ (જો લાગુ નહીં હોય તો છેકી નાખો)

શીર્ષક	મૂળ નામ	પરચેનું નામ	અટક
પાલકનું નામ:			

જન્મતારીખ (સગીરની):

જન્મતારીખ (પાલકની):

સગીર સાથે સંબંધ: ☐ પિતા ☐ માતા ☐ કોર્ટના આદેશી (જો હા હોય તો કૃપા કરી કોપી લગાવો) ☐ અન્ય (કૃપા કરી ચોખવટ કરો)

હું સગીર પુખ્તાવસ્થામાં આવે ત્યાં સુધી ઉક્ત અકાઉન્ટમાં કોઈ પણ વિવરણની સર્વ ભાવિ લેણદેણમાં સગીરનું પ્રતિનિધિત્વ કરીશ. હું તેના/તેણીના અકાઉન્ટમાંથી મારા દ્વારા કરવામાં આવનારા કોઈ પણ ઉપાડ/લેણદેણના ફક્ત સગીરના કોઈ પણ દાવા સામે બેન્કને અતિમ રાખું છું.

પાલકની સહી

અકાઉન્ટના સંચાલન માટે સૂચના

☐ એકલ ☐ બેમાંથી એક અથવા હયાત રહેનાર* ☐ ભૂતપૂર્વ અથવા હયાત રહેનાર* ☐ કોઈ પણ એક અથવા હયાત રહેનાર* ☐ સર્વ દ્વારા સંયુક્ત રીતે ☐ અન્ય (કૃપા કરી ચોખવટ કરો)
☐ *અમે વ્યાજ સાથે મૂળ રકમ ચૂકવવા આઈડીબીઆઈ બેન્ક લિ.ને સંયુક્ત રીતે સંમતિ અને અધિકૃતિ આપીએ છીએ અને મેચ્યુરિટીની તારીખ પૂર્વે કોઈ પણ દિવસે અમારા કોઈ પણ પાસેથી લેખિત સૂચના પર ફિક્સ્ડ ડિપોઝિટનો પ્રીમેર્યોર ઉપાડ કરવા પરવાનગી આપીએ છીએ.

1લો અરજદાર

2જો અરજદાર

3જો અરજદાર

4થો અરજદાર

સહી

સહી

સહી

સહી

અરજદાર/પાલકે ફોટોગ્રાફની ઉપર તેમ જ સહી માટે આપવામાં આવેલા જગ્યામાં પણ સહી કરવાની રહેશે.

પરિચયકર્તાની વિગતો

☐ મોજૂદ આઈડીબીઆઈ બેન્ક અકાઉન્ટ ધારક દ્વારા પરિચય (અરજદારને નામે મેઈલિંગ એડ્રેસન સમર્થન આપતા દસ્તાવેજ પૂરા પાડવાના રહેશે)

નામ:

કરન્ટ અરજદાર: અકાઉન્ટ નં.:

હું સમર્થન આપું છું કે છ મહિનાથી વધુ સમયથી આઈડીબીઆઈ બેન્કમાં અકાઉન્ટ ધારક છું. હું સમર્થન આપું છું કે અંગત રીતે અરજદારને અહીં આપેલી વિગતો અનુસાર વર્ષથી જાણું છું અને તેની/તેણીની ઓળખ અને સરનામાને સમર્થન આપું છું.

પરિચયકર્તાની સહી

સહી વેરિફાઈ કરાઈ (બેન્કના ઉપયોગ માટે)

સહી અને ઇઆઈએન નં.

સ્વ પરિચય

આરંભિક પેમેન્ટ્સની વિગતો (સેવિંગ્સ / કરન્ટ / ટર્મ ડિપોઝિટ અકાઉન્ટ માટે)

नवीन प्रॉडक्ट्स / ऑफर्स सांगायची संमती (ईमेल एसएमएस पोस्ट आणि टेलिबॉकिंगद्वारे): शं अपाशे

☐ નિવેદન (દમિયનસાથી જ) ☐ પાસબુક ☐ ચેકબુક

ચેનલ સેવાઓ

☐ ઈન્ટરનેટ બેન્કિંગ ☐ મોબાઇલ બેન્કિંગ ☐ ફોન બેન્કિંગ ☐ ષોટસઅપ બેન્કિંગ ☐ એસએમએસ એલર્ટસ ☐ ઈ-મેઇલ એલર્ટસ

પ્રાઇમરી કાર્ડ

1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32	33	34	35	36	37	38	39	40	41	42	43	44	45	46	47	48	49	50	51	52	53	54	55	56	57	58	59	60	61	62	63	64	65	66	67	68	69	70	71	72	73	74	75	76	77	78	79	80	81	82	83	84	85	86	87	88	89	90	91	92	93	94	95	96	97	98	99	100
---	---	---	---	---	---	---	---	---	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	----	-----

કૃપા કરી નોંધ લો:

- ચેનલ સેવાઓ અને ઇન્ટરનેશનલ ડેબિટ ક્રમ એટીએમ કાર્ડ માટે ઘોષણા

હું/અમે આઈડીબીઆઈ બેન્કનું મેન/અમેન આઈડીબીઆઈ બેન્ક ડાઉન્ટ કમ અટાચમેન્ટ હેઠળ જરૂરી કરવા આઈડીબીઆઈ આપીએ છીએ. હું/અમે સમયોત્તર અમલો નિયમો અને શરતો દ્વારા ડાઉન્ટ હેઠળ જરૂરી કરવાનું અને ઉપયોગ શોધત તથા તેને પહેલું આપીએ છીએ અને તેનાથી નિર્ધારિત રહેવા સંમત છીએ. હું/અમે સ્વીકારીએ છીએ કે નિયમો અને શરતો સમયોત્તર આઈડીબીઆઈબેન્ક દ્વારા સુધારણાને આધીન રહેશે. હું/અમે વધુમાં બિનશરતી અને અફર રીતે આઈડીબીઆઈબેન્કને ડેબિટ કમ એટીએમના ઉપયોગ માટે વાર્ષિક રૂ. અને શુલ્કની સમકક્ષ રકમ

[illegible]

અન્ય ઘોષણાઓ

☐ સેવિંગ્સ અકાઉન્ટમાં સ્વીપ: જો મારા સેવિંગ્સ અકાઉન્ટ નં. _____ માં બેલેન્સ અપૂરતી હોય તો

સરનામાના ફેરબદલીની જાણકારી

પણ ફેરફાર થાય તો સરનામાના પુરાવા સાથે નવા સરનામાની વિગતો આવા ફેરફારના બે સપ્તાહમાં શાખાને સુપરત કરાશે.

☐ સીક્રિવાયસી: હું એઓએફમાં આપેલી વિગતો સાથે અકાઉન્ટ જોલાવવાનો હેતુ/સીક્રિવાયસી અપડેશન માટે સીક્રિવાયસી રેકૉર્ડ ડાઉનલોડ કરવા માટે મારી સંમતિ આપું છું.

☐ હું/અમે કોઈ પણ અન્ય બેન્ક/કો સાથે કોઈ પણ ધિરાણ સુવિધાઓ મારાતા નથી. ☐ હું/અમે અન્ય બેન્ક/કો સાથે ધિરાણ સુવિધા મારાણે છીએ/કરંટ અકાઉન્ટ ધરાવીએ છીએ (ફૂપા કરી અલગથી વિગતવાર આવી સુવિધાઓની વિગતો જોડો)

અકાઉન્ટ નંબર	સુવિધા	રકમ

☐ એલ્યુમિનિયમ અક્ષરો (જા. સી. સ્ટેટેલી લાભાર્થી આલિડ લોભાગ આગત કરો)

અને નીચે મુજબ જાહેર કરીએ છીએ, હું નિમ્નલિખિત સહીકર્તા, કંપનીનો એકત માલિક છું અને તે અનુષંગે લાયબિલિટીઓ માટે એકમેવ જવાબદાર છું. હું કંપનીના બંધારણમાં થઈ શકનારા કોઈપણ ફેરફારની લેખિતમાં તમને સલાહ આપીશ અને હું આવી સૂચનાની પ્રાપ્તિની તારીખના રોજ તમારા પુસ્તકોમાં કંપનીને નામે રહેલી કોઈપણ જવાબદારીઓ માટે અને આવી સર્વ જવાબદારીઓ લિક્વિડેટ નહીં થાય ત્યાં સુધી તમને ઉત્તરદાયી રહીશ.

મારા અકાઉન્ટ સાથે આધાર નંબર જોડવો (ઘોષણા)

રૂપા કરા મારા આધાર નં. મારા અકાઉન્ટ સાથે જોડા (સંયુક્ત અકાઉન્ટ્સના કિસ્સામાં ફક્ત પ્રથમ ધારકના આધાર નંનર અકાઉન્ટનં જોડા શકાય છે, સર્વ અન્ય ધારકોના સમાત માટ તમના સહોઆ લેવાનું કરજિયાત છે) (આધાર પત્ર / ઈ-આધારની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે).

સુવિધા ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી)

ફિપોઝિટની મુદત: દિવસ મહિનો વર્ષ

સુવિધા એફડી વ્યાજ દરની ચુકવણી: ☐ માસિક (ફિક્સ્ડ ડેટ આધારે) ☐ ત્રિમાસિક ☐ વાર્ષિક ☐ મેચ્યુરિટી સમયે (એકત્રિત)

વરિષ્ઠ નાગરિકો: ☐ ના ☐ હા (ફૂપા કરી પુરાવો જોડો)

☐ નોન- કોલેબલ એફડી (વહેલો ઉપાડ મંજૂર નથી)

ટીડીએસ માટે (ફૂપા કરી લાગુ અનુસાર નિશાન કરો): ☐ સ્રોત ખાતે કાપવાનો કર - પેન/જીઆઈઆર નં. અથવા

☐ કર કાપવાનો નથી - ફોર્મ 15જી/5એચ જોડવામાં આવ્યાં છે

મેચ્યુરિટી/પેમેન્ટ અંગે સૂચના

☐ ઓટો રિન્યુ* મૂળ રકમ ☐ ઓટો રિન્યુ* મૂળ રકમ અને વ્યાજ ☐ ઓટો રિન્યુ* ₹	કેટલા સમયગાળા માટે ઓટો રિન્યુ: વર્ષ(ર્ષો) મહિના(ઓ) દિવસ(સો) *નવીનીકરણ તે સમયે પ્રવર્તમાન વ્યાજ દરે કરાશે.	☐ મૂળ રકમ અને વ્યાજની ચુકવણી કરો ☐ મૂળ રકમ ચુકવણી કરો
---	--	--

☐ 1લા અરજદારના ઓપરેટિવ અકાઉન્ટમાં જમા કરીને અથવા ☐ પેઓર્ડર/ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા ☐ અન્ય બેન્ક

બેન્કનું નામ અકાઉન્ટ નં.

અકાઉન્ટનો પ્રકાર આઈએફએસસી કોડ

#આઈડીબીઆઈ બેન્ક અકાઉન્ટ સિવાય, એક કેન્સલ કરેલો ચેક ફરજિયાત છે.

કોર્પોરેટ પેરોલ અકાઉન્ટ માટે - ફક્ત કોર્પોરેટ સેલરી અકાઉન્ટ્સ માટે ભરવાનું રહેશે (જો લાગુ હોય) -

કોર્પોરેટનું નામ

કોર્પોરેટનું લેબલ

કંપનીના નિયુક્ત અધિકારીનું નામ

અધિકારીનો હોદ્દો

રિફ્રેન્સમેન્ટ અકાઉન્ટ: ☐ હા ☐ ના

નોંધ: #રોકડ રકમ સાથે અકાઉન્ટ ખોલાવવાનું હોય તો આઈડીબીઆઈ બેન્ક (ઘરઆંગણાની શાખા)માં જ જમા કરવાના રહેશે.

અધિકૃત કંપનીના અધિકારીની સહી

કંપનીનું સીલ

શાખા પ્રમુખનું વેરિફિકેશન

ફક્ત બેન્કના ઉપયોગ માટે

☐ અગ્રતાથી પ્રક્રિયા કરવાનું રહેશે ☐ ફક્ત ગ્રાહક આઈડી નિર્માણ કરવા માટે

- અમે કેવાયસી અને એએમએલ નીતિની સર્વ આવશ્યકતાઓનું પાલન કર્યું છે. બેન્કના કેવાયસી અને એએમએલ માસ્ટર પરિપત્રો હમણાં સુધી અપડેટ રાખ્યા છે.
- અમે પ્રસ્તાવિત પ્રોડક્ટ સંબંધમાં બેન્ક દ્વારા જારી સર્વ આવશ્યકતાઓ, પરિપત્રો/સૂચનાઓનું તે તારીખ સુધી પાલન કર્યું છે.
- અપડેટ જારી સર્વ કાનૂની, નિયામક અને આંતરિક માર્ગદર્શિકાનું આ એઓએફ સંબંધમાં પાલન કરાયું છે.
- નહું અત્રે પ્રમાણિત કરું છું કે સર્વ જરૂરી કેવાયસી દસ્તાવેજો મારા દ્વારા પ્રાપ્ત/વેરિફાઈ કરાયા છે. હું સમર્થન આપું છું કે મ મારી પાસે આતંકવાદી સમૂહોની વેરિફાઈ કરેલી યુએનની યાદી અને ભારત સરકારના એડવાઈસીસ અને બેન્કની માર્ગદર્શિકાઓ ધરાવું છું અને સમર્થન આપું છું કે અરજદાર/રો ચેતવણીના એડવાઈસીસ/વ્લેક લિસ્ટમાં સમાવિષ્ટ નથી. આને આધારે આ અકાઉન્ટ ખોલી શકાય.

શાખા પ્રમુખ/કાર્યવાહક શાખા પ્રમુખનું નામ

તારીખ એમ્પ્લોયી કોડ શાખા

ડીએસટ કોડ: 1 લેબલ કોડ: 1

ડીએસટ કોડ: 2 લેબલ કોડ: 2

યુસીઆઈસી કોડ:

યોજનાનો કોડ બીએસઆર કોડ:

વર્ટિકલનું નામ

અકાઉન્ટ નં.

કસ્ટમર આઈડી 1

કસ્ટમર આઈડી 2

કસ્ટમર આઈડી 3

કસ્ટમર આઈડી 4

સહી

પહોંચ

અરજી ફોર્મ નં. શાખાની નકલ

ગ્રાહકનું નામ

નિમ્નલિખિત પર સીપીયુ /આરપીયુ દ્વારા ક્વેર્ડેડ

પહોંચ

અરજી ફોર્મ નં. ગ્રાહકની નકલ

(ફૂપા કરીને તમારી કસ્ટમર આઈડી મળે નહીં ત્યાં સુધી આ નંબર યાદ રાખો)

પહોંચની તારીખ:

બેન્ક અધિકારીની સહી

ફોર્મ ડીએ 1- નોમિનેશન ફોર્મ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 45 ઝેડએ અને બેન્કિંગ કંપનીઝ (નોમિનેશન) રુલ્સ 1985ના નિયમ 2(1) હેઠળ બેન્ક ડિપોઝિટ્સ સંબંધમાં નોમિનેશન

હું/અમે (નામ) (નામ)

સરનામું સરનામું

નમ્નલિખિત વ્યક્તિને નોમિનેટ કરીએ છીએ, જેને મારા/અમારા/સગીરના મૃત્યુના સંજોગોમાં અકાઉન્ટ(ન્ટ્સ)માં જમા રકમ, જેનું વિવરણ નીચે મુજબ છે તે આઈડીબીઆઈ બેન્ક લિમિટેડની શાખા દ્વારા રિટર્ન કરી શકે છે.

ડિપોઝિટનો પ્રકાર અકાઉન્ટ નં. વધારાની વિગતો, જો કોઈ હોય તો

નોમિની

નામ

ટપાલનું સરનામું

શહેર રાજ્ય પિન કોડ

દેશ

ડિપોઝિટર સાથે સંબંધ (જો કોઈ હોય તો): ઉંમર (વર્ષ):

નોમિનીના પાલક (જો નોમિની સગીર હોય): પિતા માતા કોર્ટ નિયુક્ત પાલક કોર્ટ રિસીવર ડિફેક્ટો ગાર્ડ અન્ય

જન્મતારીખ (જો નોમિની સગીર હોય)

*નોમિની આ તારીખના રોજ સગીર હોય તો હું/અમે નિયુક્ત કરીએ છીએ શ્રી /શ્રીમતી/કુ.

ટપાલનું સરનામું

શહેર રાજ્ય પિન કોડ

દેશ , નોમિનીની સગીરાવસ્થા દરમિયાન મારા/અમારા/સગીરના મૃત્યુના સંજોગોમાં નોમિની વતી અકાઉન્ટમાં ડિપોઝિટની રકમ પ્રાપ્ત કરી શકશે.

કૃપા કરી નોંધ કરો: ઓટો સ્વીપ આઉટ પદ્ધતિથી નિર્માણ કરેલી ફિક્સ્ડ ડિપોઝિટ્સ લિંકડ સેવિંગ્સ/કરન્ટ અકાઉન્ટમાં આપવામાં આવ્યા મુજબ તે જ નોમિનેશન ધરાવશે.

☐ હું નોમિનેશન સુવિધા લેવા માગતો નથી.

1લા અરજદારની સહી 2જા અરજદારની સહી 3જા અરજદારની સહી 4થા અરજદારની સહી

સાક્ષીદાર(રો) ***

નામ નામ

સહી*** સહી***

સરનામું સરનામું

સ્થળ સ્થળ

તારીખ તારીખ

*જો નોમિની સગીર નહીં હોય તો છેડી નાખો. **ડિપોઝિટ સગીરને નામે કરવામાં આવી હોય ત્યાં નોમિનેશન પર સગીર વતી કાયદેસર રીતે ફૂટિ કરવા હકદાર વ્યક્તિ દ્વારા સહી કરવાની રહેશે. *** અંગૂઠાનાં નિશાન(નો)ને બે સાક્ષીદાર દ્વારા પ્રમાણિત કરવાનાં રહેશે.

નોંધણી નં. (બેન્ક દ્વારા જ ભરવાનું રહેશે)

નોમિનેશન માટે પહેલ્ય

નિમ્નલિખિત સંબંધમાં તમારા નોમિનેશન ફોર્મ ડીએ 1ને અમે પહેલ્ય આપીએ છીએ:

અકાઉન્ટનો પ્રકાર	અકાઉન્ટ નંબર	વધારાની વિગતો, જો કોઈ હોય તો

અમારી પાસે ધરાવાતા _____ ને નામે

કૃપા કરી આ સંબંધમાં અમારી સાથે સર્વ ભાવિ સંદેશવ્યવહારમાં નોમિનેશન નંબર _____ ક્વોટ કરો.

ભાગ II (અંગત વિગતો)

ભાગ-IIમાં દરેક અરજદાર દ્વારા અલગથી ભરવાનું રહેશે

ગ્રાહકનો પ્રકાર	☐ વ્યક્તિગત	☐ માલિકી	☐ કર્મચારી	☐ માજી કર્મચારી	ઈઆઈએન	☐ અન્ય
ગ્રાહક બંધારણ:	☐ પુરુષ	☐ સ્ત્રી	☐ માલિકી કંપની			
નામ	શીર્ષક મૂળ નામ વરચેનું નામ અટક					
	જન્મતારીખ (તારીખ/મહિનો/વર્ષ)		જાતિ: પુરુષ/સ્ત્રી/ તૃતીયપંથી	વૈવાહિક સ્થિતિ: એમ /એસ /ઓ	પ્રથમ અરજદાર સાથે સંબંધ	માતાનું પિયરનું સરનામું
*પેન/જીઆઈઆર			અથવા ☐	ફોર્મ 60 જોડવામાં આવ્યું છે (ફૂપા કરીને ✓)		
પાસપોર્ટ નં.			જારી તારીખ	સમાપ્તિ તારીખ		
પાસપોર્ટની વિગતો						
સિકેવાયસીઆર આઈડી: હા ☐	સિકેવાયસીઆર નં.		ના ☐			
જો 'હા' હોય તો સિકેવાયસીઆર નં. ભરવાનું ફરજિયાત છે / જો 'ના' હોય તો સિકેવાયસીઆર નોંધણી ફોર્મ ભરો.						
આધાર સંદર્ભ ક (એઆરકે)			લિંક: હા* ☐	ના ☐ *ડેબિટ બેનિફિટ ટ્રાન્સફર લિન્કિંગ માટે		
કંપનીનું નામ (એકલ માલિકી માટે)						
મોબાઈલ નં.			ઓફિસનો ફોન નં.			
ઈમેઈલ આઈડી						
પત્રવ્યવહારનું સરનામું						
બિલ્ડિંગ/રોડ નં.						
			વિસ્તાર	ગામ		
શહેર/નગર/તાલુકો			સીમાચિહ્ન (નજીક /સામે)			
જિલ્લો			રાજ્ય	પિન કોડ		
દેશ			ફોન (નિવાસ)	ફેક્સ નં.		
વિસ્તારનો કોડ: રાજ્ય	જિલ્લો	પેટા જિલ્લો	ગામ			
		(તાલુકો)				
કાયમી સરનામું	☐ ઉકત અનુસાર					
બિલ્ડિંગ/રોડ નં.						
			વિસ્તાર	ગામ		
શહેર/નગર/તાલુકો			સીમાચિહ્ન (નજીક /સામે)			
જિલ્લો			રાજ્ય	પિન કોડ		
દેશ			ફોન (નિવાસ)	ફેક્સ નં.		
મોજૂદ કર્ટમર આઈડી	ફૂપા કરી ઉકત સંપર્ક વિગતો, સરનામું, મોબાઈલ/ફોન નં., ઈમેઈલ આઈડી વગેરે અપડેટ કરો ફક્ત નવા અકાઉન્ટમાં ☐ મારી/અમારી કર્ટમર આઈડી હેઠળ ટેન્ડ સર્વ અકાઉન્ટ માટે ☐					

ગ્રાહકની રૂપરેખા (વ્યક્તિગતો/સ્વરોજગારીઓની વધારાની માહિતી)

નિવાસી સ્થિતિ	☐ નિવાસી	☐ બિન-નિવાસી				
શિક્ષણ	☐ નિરક્ષર	☐ અંડરગ્રેજ્યુએટ	☐ ગ્રેજ્યુએટ	☐ પોસ્ટ ગ્રેજ્યુએટ	☐ પ્રોફેશનલ	
વ્યવસાય	☐ રાજ્ય સરકારમાં નોકરી					☐ અન્ય વ્યાવસાયિક
	☐ કેન્દ્ર સરકારમાં નોકરી					☐ વેપાર – ઉત્પાદન/ઉદ્યોગપતિ
	☐ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (પીએસયુ)માં નોકરી					☐ વેપાર – સેવા
	☐ સંસ્કારમાં નોકરી					☐ ગૃહિણી
	☐ ખાનગી ક્ષેત્રમાં નોકરી					☐ વિદ્યાર્થી
	☐ સ્વરોજગારી વ્યાવસાયિક – ડોક્ટર/તબીબી વ્યવસાય					☐ આર્ટિસ્ટ/તેખડો વગેરે
	☐ સ્વરોજગારી વ્યાવસાયિક – વકીલ/કાનૂની વ્યવસાય					☐ કેપિટલ માર્કેટ મેકર
	☐ સ્વરોજગારી વ્યાવસાયિક – સીએ/આઈસીડબ્લ્યુએ/ટેક્સેશન/ફાઈનાન્સ વ્યવસાય					☐ વેપાર – ટ્રેડિંગ
	☐ સ્વરોજગારી વ્યાવસાયિક – એન્જિનિયર/ટેકનિકલ કન્સલ્ટન્ટ્સ					☐ નિવૃત્ત
	☐ આર્ટિસન/ક્રાફ્ટ્સમેન					☐ કૃષિ
	☐ પત્રકાર					☐ સ્વરોજગાર – રિયલ એસ્ટેટ
	☐ સ્વરોજગારી					
નોકરીમાં હોય તો સંસ્થાનું નામ						
વેપારનો સ્વરોજગારી પ્રકાર હોય તો વેપારમાં ક્યારથી (વર્ષ)	☐ ટ્રેડિંગ	☐ ઉત્પાદન	☐ સર્વિસીસ	☐ કૃષિ	☐ રિયલ એસ્ટેટ	☐ પ્રવૃત્તિની રેખા (ફરજિયાત)
જો સ્વરોજગારી વ્યાવસાયિક હોય તો	☐ સીએ	☐ ડોક્ટર	☐ વકીલ	☐ શેર બ્રોકર	☐ કન્સલ્ટન્ટ	☐ પ્રવૃત્તિની રેખા (ફરજિયાત)
આવકનો સ્રોત	☐ પગાર	☐ વેપાર	☐ કૃષિ	☐ વારસાગત	☐ રોકાણ	☐ અન્ય, ફૂપા કરી યોજવટ કરો

વાર્ષિક આવક (કૃપા કરી છેલ્લામાં છેલ્લું આઈટી રિટર્ન/ફોર્મ 16/સેલરી સ્લિપની નકલ જોડો)	☐ < ₹60,000 ☐ ₹60,000 - ₹1 લાખ ☐ > ₹1 લાખ - ₹5 લાખ ☐ > ₹5 લાખ - ₹15 લાખ ☐ > ₹15 લાખ
ધર્મ	☐ હિંદુ ☐ મુસ્લિમ ☐ ખ્રિસ્તી ☐ શીખ ☐ અન્ય, કૃપા કરી ચોખવટ કરો
શ્રેણી	☐ સામાન્ય ☐ ઓબીસી ☐ એસસી ☐ એસટી
લેણદેણની રૂપરેખા, એટલે કે, માસિક /ત્રિમાસિક /અર્ધવાર્ષિકમાં અકાઉન્ટ થકી રાઉન્ટ કરવાની શક્યતા ધરાવતી લેણદેણનું મૂલ્ય. જો નવી કંપની હોય તો ગત ત્રિમાસિક અથવા ધારેલા વેચાણનું સેલ્સ ટેક્સ રિટર્ન સ્વીકારી શકાય છે: ☐ < ₹50,000 ☐ < ₹1,00,000 ☐ < ₹10 લાખ ☐ < ₹100 લાખ ☐ > ₹100 લાખ	
શાખા કાર્યાલયો/સંલગ્નિત સહયોગી કંપનીઓની વિગતો અને તેમના વેપારનો પ્રકાર	
જો કોઈ હોય તો વિદેશી જોડાણની વિગતો	
નિવાસ	☐ પોતાનું ☐ લીઝ પર ☐ અન્ય, કૃપા કરી ચોખવટ કરો
જોખમની સપાટી (ગ્રાહકની રૂપરેખા)	
સપાટીના વર્ગીકરણને આધારે	

સહી

મારું કાર્ય જીવન

ઓફિસનું સરનામું શહેર પિન

સંસ્થાનો પ્રકાર: ☐ પબ્લિક લિ. ☐ પ્રાઇવેટ લિ. ☐ જાહેર ક્ષેત્ર ☐ માલિકી

મારો પરિવાર અને હું

જીવનસાથીનું નામ-શ્રી/શ્રીમતી:

જીવનસાથીની જન્મતારીખ: લગ્નની તિથિ:

મારે માટે મહત્વપૂર્ણ અન્ય તારીખો: 1. અવસર તારીખ

2. અવસર તારીખ

સંતાનની વિગતો:

નામ	પુરુષ/સ્ત્રી/તૃતીયપંથી	જન્મતારીખ	વૈવાહિક સ્થિતિ (પરિણીત/એકલ/ઓ)

મારું બેન્કિંગ અને ફાઇનાન્સ

આઈડીબીઆઈ બેન્ક સાથે મારો સંબંધ: ☐ સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ ☐ ફિક્સ્ડ ડિપોઝિટ્સ ☐ કરન્ટ અકાઉન્ટ ☐ પર્સનલ લોન ☐ હોમ લોન

☐ સેલરી અકાઉન્ટ ☐ પેન્શન અકાઉન્ટ ☐ ડિમેટ ☐ જામીનગીરી સામે લોન

બેન્કિંગ માટે મારી અગ્રતાની ચેનલો: ☐ એટીએમ ☐ ઈન્ટરનેટ બેન્કિંગ ☐ ફોન બેન્કિંગ ☐ મોબાઈલ બેન્કિંગ ☐ બ્રાન્ચ બેન્કિંગ

રોકાણની વિગતો:

વાર્ષિક પારિવારિક આવક: % બચત/રોકાણ

મારા પરિવારમાં કમાતા સભ્યોની સંખ્યા:

મારી અન્ય બેન્કરો: 1) 2)

મારાં ક્રેડિટ કાર્ડ્સ: કાર્ડ્સની સંખ્યા 1) જારીકર્તાનું નામ 2) જારીકર્તાનું નામ

લોન: ☐ શૈક્ષણિક લોન ☐ હોમ લોન ☐ જામીનગીરી સામે લોન

મારો વીમો: મારી કારનો વીમો છે નવીનીકરણની આખર તારીખ

મારું જીવન વીમા રક્ષણ વીમેદાર

મને ફાઇનાન્સ પર સલાહ આપનાર ☐ પોતે ☐ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ☐ નાણાકીય સલાહકાર ☐ અન્ય બેન્કર ☐ અન્ય

મોજૂદ પોર્ટફોલિયો: ઈક્વિટી બજારો %, મ્યુચ્યુઅલ ફંડ્સ %, મિલકત %, બોન્ડ્સ %, બેન્ક એફડી %, અન્ય %

મારી જીવનશૈલી:

મને ગમે છે: ☐ પ્રવાસ ☐ વેકેશન પર જવું ☐ વાંચન ☐ પાર્ટી કરવી ☐ સ્પોર્ટ્સ/ગેમ્સ ☐ બહાર ભોજન કરવા જવું ☐ યોગા/દયાન ☐ શોપિંગ

☐ પરફોર્મિંગ આર્ટ્સ ☐ ફોટોગ્રાફી ☐ કલેક્શન ☐ ફાઇન આર્ટ્સ ☐ અન્ય

હું દ્રાઈવ કરું તે વાહન:

મારી મનગમતી વાનગી: ☐ ભારતીય ☐ ચાચનીઝ ☐ થાઈ ☐ ફ્રેન્ચ ☐ ઈટાલિયન ☐ મેક્સિકન ☐ ઘરે બનાવેલું ખાવાનું

મારું અગ્રતાનું વેકેશન સ્થળ: ☐ હિલ ☐ દરિયાકાંઠો ☐ ફ્રેઝ ☐ ધાર્મિક યાત્રા ☐ વાઈલ્ડલાઈફ ☐ હેલ્થ રિસોર્ટ્સ ☐ પૂર્વજનું ઘર

મારું અગ્રતાનું સંગીત: ☐ ગાયન ☐ પોપ ☐ રિમિક્સ ☐ ગઝલ ☐ વેસ્ટર્ન ☐ પારંપરિક ☐ ધાર્મિક

☐ ઈન્ટ્રુમેન્ટલ ☐ અન્ય

હું વાંચું તે પુસ્તકો/અખબારો: હું વાંચન માટે અગ્રતા આપું તે ભાષા

અગ્રતાના વિષયો: ☐ હસ્તીઓ ☐ સાહિત્ય ☐ ઇતિહાસ ☐ પ્રેરણાત્મક ☐ ફિક્શન ☐ અન્ય

હું સામાન્ય રીતે પ્રવાસ કરું તેનું કારણ ☐ બિઝનેસ ☐ લીઝર ☐ બંને

મારી ફેવરીટ એરલાઈન: ભારતમાં વિદેશમાં

બિન-અંગત કંપનીઓના કિસ્સામાં લાભાર્થી માલિકની ઘોષણા (માલિકી અકાઉન્ટ)

અમે સુપરત કરીએ છીએ કે અમે ભારત સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાઓ (નીચે આપવામાં આવ્યા મુજબ) અનુસાર લાભાર્થી માલિકની વ્યાખ્યા વાંચી અને સમજી છે અને અત્રે સલાહ આપીએ છીએ કે નિમ્નલિખિત વ્યક્તિ/કંપની અમારી કંપનીની લાભાર્થી માલિક છે. અમે તમારી નોંધ માટે કથિત લાભાર્થી માલિકની ઓળખની વિગતો પણ પૂરી પાડી છે.

લાભાર્થી માલિકનું નામ	
સરનામું	
ફોન નંબર	
ઈમેલ	
બીડાણ અનુસાર	લાભાર્થી માલિકની ઓળખ માટે પુરાવો

અમે અત્રે જાહેર કરીએ છીએ કે ઉક્ત માહિતી સાચી છે અને પ્રસ્તાવ અનુસાર અમારું અકાઉન્ટ જોલાવવા માટે તમને વિનંતી કરીએ છીએ. અમે અમારી કંપનીના લાભાર્થી માલિકમાં કોઈ પણ ફેરફાર હોય તો તમને જાણકારી આપવાની પણ બાંધધરી આપીએ છીએ.

તમારો હિતેચ્છુ,
-----સહી-----

આઈડીબીઆઈ બેન્ક લિ. શાખા

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો (એમઆઈટીસી)

અરજદારને હસ્તક સોંપવું

કૃપા કરી શાખામાં ઉપલબ્ધ બીસીએસબીઆઈ કોડ્સની નકલ પ્રાપ્ત કરો. ઉપરાંત તમારા દ્વારા સહી કરાયેલી શિડ્યુલ ઓફ ફેસિલિટી (એસઓએફ)ની નકલ જાળવી રાખવાની પણ વિનંતી છે.

સેવિંગ્સ બેન્કના નિયમો

- એસબી અકાઉન્ટ્સ બંધાવવાના હેતુથી જોલાવી શકાય છે અને કોઈ પણ વેપારી કામકાજ કરવા માટે નહીં. સેવિંગ્સ બેન્ક અકાઉન્ટનો હેતુ ખાનગી નાગરિકોને તેમની બચતો બેન્કમાં જમા કરવા પ્રોત્સાહન આપવાનો છે, જેથી આ રીતે જમા કરેલી રકમ પર તેમને વ્યાજ મળે અને માગણી પર અમુક મર્યાદિત ઉપાડની સુવિધા પણ મળે. આથી પેઢીઓ/કંપનીઓને એસબી અકાઉન્ટ જોલાવવા મંજૂરી અપાતી નથી. કમર્શિયલ પ્રકારની લેણદેણ તેમાં મંજૂર નથી. જો બેન્કને કોઈ પણ તબક્કે એવું જણાય કે સેવિંગ્સ બેન્ક અકાઉન્ટનો ઉપયોગ મંજૂર નથી તેવા હેતુ માટે કરાય છે અથવા શંકાસ્પદ કે અનિચ્છનીય વ્યવહારો કરવા માટે કરાય છે તો બેન્ક આપું સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ બંધ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
- અકાઉન્ટમાં હંમેશાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવી જોઈએ. જો લઘુત્તમ બેલેન્સ નહીં જાળવી રખાય તો સમયાંતરે મુકરર અનુસાર શુલ્ક લાગુ થશે.
- સમયાંતરે અકાઉન્ટ બંધ કરવા માટે લાગુ શુલ્ક વસૂલ કરાશે.
- વ્યાજ રોજની જમા રીત પર એસબી અકાઉન્ટમાં જાળવવામાં આવતી બેલેન્સ પર ગણતરી કરાશે અને દરેક માર્ચ અને સપ્ટેમ્બરના છેલ્લા કામકાજના દિવસે અકાઉન્ટમાં જમા કરાશે. ચૂકવવાપાત્ર વ્યાજ દર આરબીઆઈ દ્વારા સમયાંતરે જારી નિર્દેશોને આધીન રહેશે.
- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષ સુધી અકાઉન્ટમાં કોઈ વ્યવહાર નહીં કરે તો અકાઉન્ટ અસક્રિય/ડોર્મન્ટ તરીકે ગણવામાં આવશે. આવાં અસક્રિય અકાઉન્ટમાં કામગીરી બેન્કની માર્ગદર્શિકા અનુસાર સુધારિત કેવાયસી દસ્તાવેજ પ્રાપ્ત કર્યા પછી પૂર્વવત/ફરી શરૂ/મંજૂર કરાશે.
- બેન્ક સેવા શુલ્કમાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે, જે માટે ગ્રાહકને બેન્કની વેબસાઈટ અને/અથવા શાખામાં સૂચના ફલક પર યોગ્ય રીતે સૂચિત કરાશે. શુલ્કની સમયસૂચિ અથવા નિયમો અને શરતોમાં કોઈ પણ ફેરફાર થાય તો ગ્રાહકને 30 દિવસ અગાઉ જાણ કરાશે. સૂચનાના સમયગાળા દરમિયાન સુવિધા માટે શુલ્ક સૂચનાના સમયગાળા પૂર્વે લાગુ હોય તે જ રહેશે.

કરન્ટ અકાઉન્ટના નિયમો

- કરન્ટ અકાઉન્ટનો અર્થ રોજ અકાઉન્ટમાં ગ્રાહક દ્વારા વેપાર હાથ ધરાય અને/અથવા મોટ સંખ્યામાં લેણદેણ કરવામાં આવે.
- કરન્ટ અકાઉન્ટમાં લેણદેણની સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી.
- કરન્ટ અકાઉન્ટમાં બેલેન્સ પર કોઈ વ્યાજ ચૂકવવાનું નથી.
- મફત સુવિધાઓ ગત/વર્તમાન મહિના દરમિયાન જાળવવામાં આવતી માસિક સરેસાશ બેલેન્સ (એમએબી)ને આધારે દરેક મહિને ભિન્ન રહેશે.

રિટેઈલ ટર્મ ડિપોઝિટના નિયમો

- જો વરિષ્ઠ નાગરિક/કર્મચારી અને નિવૃત્ત કર્મચારી સહિત ડિપોઝિટરોની કોઈ પણ શ્રેણી દ્વારા 15 દિવસ પૂર્વે ડિપોઝિટનો પ્રીમેયરોર ઉપાડ કરવામાં આવે તો લાગુ વ્યાજ દર વસૂલ કરાશે (પ્રીમેયરોર ઇન્ડ નહીં). જો ડિપોઝિટ 7 દિવસથી ઓછી મુદત માટે રાખી હોય તો કોઈ વ્યાજ નહીં ચૂકવશે, જે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ટર્મ ડિપોઝિટ માટે લઘુત્તમ સમયગાળો છે.
- તમારા એફડી માટે લાગુ વ્યાજ દર પ્રવર્તમાન વ્યાજ દર અનુસાર રહેશે. ડિસ્કાઉન્ટેડ દર માસિક વ્યાજની ચૂકવણીના કિસ્સામાં લાગુ થશે.
- પ્રીમેયરોર/આંશિક ઉપાડ/સ્વીપ-ઈન ડિપોઝિટ્સ પર વ્યાજ બેન્ક પાસે જમા રહેલી રકમ અને સમયને આધારે લાગુ દર ચૂકવવામાં આવશે (અને કરારબદ્ધના દરે નહીં), જેમાંથી 1 ટકાનો ઇન્ડ ઓછો કરાશે.
- પ્રીમેયરોર/આંશિક ઉપાડ/સ્વીપ-ઈન નોન-કોલેબલ ડિપોઝિટ્સ પર મંજૂર નથી.

ફ્લોટિંગ ટર્મ ડિપોઝિટના નિયમો

- તમારી ફ્લોટિંગ ટર્મ ડિપોઝિટ પર લાગુ વ્યાજ દરો પ્રવર્તમાન વ્યાજ દરો અનુસાર રહેશે. વ્યાજ તમારા ફ્લોટિંગ ટર્મ ડિપોઝિટને લાગુ તુરંત ત્યાર પછીના ત્રણ મહિનાના વ્યાજ દરો દરમિયાન 91 દિવસના ટ્રેઝરી બિલ્સ ઓક્શન્સ ખાતે સરેશા ઊપજે એન્ડર્ડ હોઈ પ્રવર્તમાન વ્યાજ દર અનુસાર રહેશે. વ્યાજ આરબીઆઈ દ્વારા હાથ ધરાયેલા તુરંત ત્યાર પછીના મહિનાઓ દરમિયાન 91 દિવસના ટ્રેઝરી બિલ ઓક્શન્સ ખાતે સરેશા ઊપજને એન્ડર્ડ રહેશે. તે દરેક તિથિ ત્રિમાસિક રિસેટ કરાશે.
- ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ લઘુત્તમ એક વર્ષના લોક-ઈન સમયગાળો ધરાવે છે અને બુકિંગની તારીખથી એક વર્ષ માટે પ્રીમેયરોર ઉપાડ મંજૂર નહીં કરાય.

આઈડીબીઆઈ બેન્ક નિમ્નલિખિત પ્રોડક્ટો અને સેવાઓ ઓફર કરે છે:

સેવિંગ્સ અકાઉન્ટ
•
ફ્લેક્સી કરન્ટ અકાઉન્ટ
•
ફિક્સ્ડ અને ફ્લોટિંગ ટર્મ ડિપોઝિટ્સ
•
રિકરિંગ ડિપોઝિટ્સ
•
એનઆરઆઈ સેવાઓ
•
ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ
•
પ્રીફ્ડ બેન્કિંગ
•
ગિફ્ટ કાર્ડ
•
વર્લ્ડ/ગ્લોબલ કરન્સી કાર્ડ
•
ક્રેડિટ કાર્ડ

બાળકો/યુવાનો/મહિલા/નોકરિયાત/
પરિષ્ઠ નાગરિકો માટે વિશેષ અકાઉન્ટ્સ
•
કેપિટલ ગેઈન્સ અકાઉન્ટ યોજના
•
મૂડીબજાર પ્રોડક્ટો
•
હોમ લોન
•
શૈક્ષણિક લોન
•
ઓટો લોન
•
મિલકત સામે લોન
•
હોમ લોન વ્યાદ બચતકર્તા
•
લોકર સુવિધા



આઈડીબીઆઈ બેન્ક લિમિટેડ, નોંધાયેલી કાર્યાલય: આઈડીબીઆઈ ટાવર, ડબ્લ્યુટીસી કોમ્પ્લેક્સ, કફ પરેડ, મુંબઈ-400005.

ટોલ ફ્રી નંબરો: 1800-209-4324 / 1800-22-1070, નોન-ટોલ ફ્રી નંબર: 022-67719100.

અમારી વિક્રિત કરો: www.idbibank.in |     